

# WELCOME



Smart  
Control

Smart  
Monitoring

Smart  
Planning

ਪ੍ਰਿਜ਼ਿੱਸ਼ਨ ਫਾਰਮਿੰਗ


ਰਵਿ ਕੁਖਿ ਮਹੋਤਸਵ ੨੦੨੪



ਜੁਨਾਗਡ ਕੁਖਿ ਯੂਨੀਵਰਸਿਟੀ, ਜੁਨਾਗਡ

# પ્રસ્તાવના

- ❖ ભારત – કૃષિપ્રદાન દેશ
- ❖ ખેતી સાથે સીધી સંકળાયેલ લોકો – ૬૬ લાખ
- ❖ ખેતી – આર્થિક આવકનું મુખ્ય સાધન





# પ્રસ્તાવના

- ❖ દેશ કે રાજ્યના વિકાસ માટે – ખેડૂતોની આર્થિક પરીક્ષિથતિ સુધારવા – ચીલાચાલુ ખેતી – ચોકસાઈ પૂર્વકની ખેતી (પ્રિસિઝન ફાર્મિંગ)
- ❖ ચીલાચાલુ ખેતી
  - કૃષિ ઈનપુટ્સ – ખાતર, નિંદળાનાશક દવા, રોગ-જીવાત નિયત્રણ માટેની દવાઓ, પિયત વગેરે જમીન તથા ખેત આબોહવાની ભિન્નતા ને દ્યાને રાખ્યા વગાર એકસરખી રીતે ઉપયોગ
  - ખેતીમાં બિનજરૂરી ખર્ચમાં વધારો

# પ્રસ્તાવના

## ❖ પ્રિસિઝન ફાર્મિંગ

- જમીન તથા ખેત આબોહવાની ભિન્નતાને ધ્યાને રાખી વૈજ્ઞાનિક ફુલે ખેતી
- ખેતીમાં કોમ્પ્યુટર, મોબાઇલ ફોન, છુપીએસ, રીમોટ સેન્સિંગ, સેન્સર, ફ્રોન અને વિવિધ સ્વચ્છાનાલિત સાધનોનો ઉપયોગ
- પાક ઉત્પાદનની ક્ષમતા તેમ જ ગુણવત્તામાં વધારો
- ચોકસાઈપૂર્વકની માવજત છારા પર્યાવરણની જાળવણી – માનવજત પર થતી પ્રદૂષણાની હાનિકારક અસરો ઘટાડી શકાય
- વિકસિત દેશો ધરણા સમયથી ઉપયોગ – ભારતમાં પ્રિસિઝન ફાર્મિંગની શરૂઆત – પરંતુ ખેડૂતોમાં તેનો વ્યાપ નહીંવત



# પ્રિસિઝન ફાર્મિંગ

- ◆ પર્યાવરણાની જાળવણી – બિયારણા, ખાતર, દવાઓ, ઓજારો, પિયત વગેરેનો ચોકસાઈ પૂર્વક ઉપયોગ
- ◆ ગુણવત્તા સભર અને મહિને માત્રામાં ઉત્પાદન
- ◆ વિકસિત દેશોની સાપેક્ષે કૃષિ ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તામાં ભારત હજુ પાછળ
- ◆ આપણા દેશમાં જુદા જુદા પાકોમાં પ્રિસિઝન ફાર્મિંગનો ધર્ણો મોટો અવકાશ
- ◆ વિશ્વ વ્યાપારીકરણ અને ઉદારીકરણ – આવનાર વર્ષોમાં ખોરાકની ઉભી થનાર સમસ્યાઓ સામે ટક્કર ઝીલવા કૃષિ ક્ષેત્રે પ્રિસિઝન ફાર્મિંગ અનેક ઉજળી તકો પૂરી પાડશે
- ◆ સ્વયં સંચાલિત સાધનો દ્વારા સ્થાનિક પર્યાવરણાનો ચોકસાઈ પૂર્વક અભ્યાસ કરી સ્થાનિક સમસ્યાને નિવારી શકે તે માટેના ચોગ્ય નિર્ણય લેવામાં ખેડૂતોને મદદરૂપ થશે



# પ્રીક્રિયન ફાર્મિંગ ના મુખ્ય હેતુઓ

- ❖ પાક ઉત્પાદન વધારવું
- ❖ ખેત પેદાર્થોની ગુણવત્તા સુધારવી
- ❖ કૃષિ ઈનપુટ્સનો કાર્યક્ષમ ઉપયોગ
- ❖ પર્યાવરણાનું સંરક્ષણ

# પ્રીક્રિયન ફાર્મિંગ ના ઘટકો

- ❖ જમીન તથા ખેત આબોહવાની વિવિધતાને સમજવી અને તેનું માપન કરવું
- ❖ જમીન તથા ખેત આબોહવાની સ્થાનિક વિવિધતાને દ્યાનમાં રાખી કૃષિ ઈનપુટ્સનું વ્યવસ્થાપન
- ❖ કૃષિ ઈનપુટ્સની કાર્યક્ષમતાનું માપન



# પ્રીસિઝન ફાર્મિંગનાં મૂળભૂત અંગો

- ❖ **માહિતી:** પાકની વાવળીથી કાપણી સુધીની દરેક અવસ્થા પ્રમાણે સમયસર અને ચોક્કસ માહિતી
- ❖ **તાંત્રિકતા:** કોમ્પ્યુટર, મોબાઇલ ફોન, લુપીએસ, રીમોટ સેન્સિંગ, સેન્સર, ફ્રોન અને વિવિધ સ્વચ્છ સંચાલિત સાધનો
- ❖ **વ્યવસ્થા:** ઉપલબ્ધ માહિતી અને તાંત્રિકતાનો સમન્વય

## પ્રીસિઝન ફાર્મિંગનાં આચામો

- ❖ કૃષિ મશીનરી
- ❖ પાક વાવેતર અને લણાણી
- ❖ પાક ઉત્પાદન વહન અને સંશ્રદ્ધ
- ❖ કૃષિ પેદાશ મૂલ્યવર્ધન
- ❖ જમીન, પાણી, ખાતર અને ઊર્જા વ્યવસ્થાપન


# પ્રિસીડન ફાર્મિંગ માટેના સાધનો

- ❖ **કોમ્પ્યુટર:** અસંખ્ય આંકડાકીય માહિતીનું ખૂબ જ ઓછા સમયમાં પૃથ્વીકરણ - જરૂરી દિશાસૂચન
- ❖ **મોબાઇલ ફોન:** વાસ્તવિક સમયના આંકડા - જમીનનો ભેજ, હવામાનની જાળાકારી અને પાકની અવસ્થાનું મોનિટરિંગ - કૃષિ વિશેષજ્ઞો સાથે જોડાઈને જાળાકારી
- ❖ **મોબાઇલ એપ્સ:** સેન્સર, ડ્રોન, અને સેટેલાઈટ તકનીકો દ્વારા ખેતરની સઘળી માહિતી



# પ્રિસીજન ફાર્મિંગ માટેના સાધનો

- ❖ **ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (અપીએસ):** જેતરની સ્થાનિક માહિતી - પ્રિસીજન ફાર્મિંગમાં કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન
- ❖ **રીમોટ સેન્સિંગ:** વિશ્વના કોઈ પણ ખૂણેથી - પાક તથા તેને લગતી માહિતીઓ - ચોગ્ય નિર્ણય



# પ્રિસીઝન ફાર્મિંગ માટેના સાધનો

- ❖ **સેન્સર:** સાચા અને વાસ્તવિક સમયના ડેટા – સુચિત નિર્ણયો લેવામા મદદુપ
  - માટીના ભેજ, તાપમાન અને પોષક તત્વોનું નિરીક્ષણ – સિંચાઈ અને ખાતર વ્યવસ્થાપન
  - હવામાન સેન્સરો – વરસાદ, ભેજ અને પવનની ગતિ વિશેની માહિતી – પાક સુરક્ષા અને આયોજન
  - મલ્ટીસ્પેક્ટ્રલ અને થર્મલ ઇમેજિંગ સેન્સરો – છોડના તણાવ, રોગો અથવા જીવાતના પ્રકોપ
  - પ્રોક્સિમિટી સેન્સરો – આપમેળે ચલાવતી મશીનરીમાં વાવળી, નિંદામણ અને ખેતરરિક્ષિયાઓ માટે

**Light level and UV radiation SU100**



**Soil T, ds18b20 and Pt100**



**HD3910.2**



**SHS**



**ECHO EC3**




**ECH-GS3**



# પ્રિસીઝન ફાર્મિંગ માટેના સાધનો

## ❖ ડ્રોન: અસરકારક, ચોકસાઈ અને સમયોચિત

- આધુનિક કેમેરા અને સેન્સરથી સર્જ ડ્રોન ખેતરનાં હવાઈ ફોટા અને વીડિયો - પાકના આરોગ્ય, જંતુની અસર અને પોષક તત્વોની અછત જાળવા
- મલ્ટીસ્પેક્ટ્રલ અને થર્મબલ ઈમેજિંગ - છોડની સ્થિતિ વિશે વિગતવાર માહિતી દવા અને ખાતર છંટકાવ - જથ્થાને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં મદદરૂપ
- પાણી વ્યવસ્થાપન - ભેજની સ્થિતિ અને પાકની જરૂરિયાતો જાળવામાં મદદ - પાણીનો ઓછો વ્યય
- સર્વેન્યિંગ - ખેતરનું મેપિંગ અને સીમાંકન - જમીન તૈયાર કરવા અને ઉપજના અંદાજમાં ઉપયોગી
- મોટા વિસ્તારને ઝડપથી આવરી લેવાની અને દુર્ગમ સ્થળોએ પહોંચવાની ક્ષમતા - ખેતીમાં કાર્યક્ષમતા વધારે - ટકાઉ ખેતી પ્રણાલીઓને પ્રોત્સાહન



# પ્રિસીઝન ફાર્મિંગ માટેના સાધનો

- ❖ **સ્વચ્છ સંચાલિત રોબોટ્સ:** ચોકસાઈ અને કાર્યક્ષમતા સાથે વિવિધ કાર્યો – વાવેતર, નીંદણા, પાકની કાપણી અને નિરીક્ષણ જેવા કાર્યોમાં મદદરૂપ
  - સેન્સર અને કેમેરાથી સજ્જ સ્વચ્છ સંચાલિત રોબોટ્સ – છોડના આરોગ્યનું નિરીક્ષણ, જીવાતોની ઓળખ અને જમીનની સ્થિતિનું વિશ્લેષણ – મજૂરીના ખર્ચને ઘટાડે – ઉત્પાદનક્ષમતા વધારે
  - ડેટા આધારિત નિર્ણયો લેવા માટે સક્ષમ – ટકાઉ અને કાર્યક્ષમ કૃષિ પ્રક્રિયાઓનો વિકાસ



# પ્રિસીઝન ફાર્મિંગનો ખેતીમાં ઉપયોગ

- ❖ **વાવળી:** ઓછા ખર્ચે વાવેતર માટેના આધુનિક ઓજાર – હેકટર દીઠ જરૂરી માત્રામાં બીજનું વાવેતર થવાથી છોડની યોગ્ય સંખ્યા જાળવી શકાય – ચોક્કસ ઊંડાઈએ અને ચોક્કસ દરે વાવેતર
- ❖ **ખાતર વ્યવસ્થાપન:** ખાતર આપવા માટે ફર્ટિલાઇઝર એપ્લિકેટર, લીઝ કલર ચાર્ટસ અને કલોરોફિલ મીટરનો પ્રીસીઝન ફાર્મિંગમાં ઉપયોગ – યોગ્ય સમયે યોગ્ય જથ્થામાં પોષક તત્ત્વોનું વ્યવસ્થાપન શક્ય
- ❖ **પિયત વ્યવસ્થાપન:** બેજનું પ્રમાણ ચોક્કસાઈથી નક્કી કરી તેના આધારે પાણીનો જથ્થો અને આપવાનો સમય નિર્દેશ – કુવારા અને ટપક પિયત પદ્ધતિથી પ્રીસીઝન ફાર્મિંગ માટે પિયતનું વ્યવસ્થાપન શક્ય
- ❖ **રોગ-જીવાત નિયંત્રણ અને વ્યવસ્થાપન:** જીપીએસ અને જીઆઈએસ વડે પ્રાદેશિક લેવલે રોગ-જીવાતનું મોટરીંગ – યોગ્ય જંતુનાશક દવા યોગ્ય સમયે અને જથ્થામાં – જેથી જંતુનાશક દવાનો વ્યય ઘટે – કાર્યક્ષમ ઉપયોગ કરી અસરકારક રીતે જીવાતનું નિયંત્રણ
- ❖ **લલણી:** પાકની પરિપક્વતા અને ફળના કલરના આધારે યોગ્ય સમયે લલણી – જીપીએસ ગાઈડ હાર્વેસ્ટર્સ, યિલ્ડ મોનિટર્સ અને સેન્સર્સ જેવી ટેકનોલોજી – પાકની ઉપજ, પરિપક્વતા અને ગુણવત્તા અંગેના ડેટાનું એકત્રિકરણ


# પ્રીસિઝન ફાર્મિંગનાં સફળતા માટે સંભવિત ટેકનોલોજી

- ❖ **પિયત વ્યવસ્થા:** ટપક – કુવારા પિયત, પાણીની વહેંચણી અને બચત – ફર્ટિગેશન
- ❖ **જમીન સપાટી પરનું આવરણ:** પ્લાસ્ટિક મન્દિરંગ, સોઇલ સોલરાઇઝેશન
- ❖ **સંરક્ષણાત્મક પર્યાવરણ:** ગ્રીનહાઉસ, લો ટનલ
- ❖ **અધતન ઓજારો:** વેરીએબલ રેટ એપિલકેટર, રીમોટ સોઇલ સેમ્પલર, ઓટોમેટિક ટ્રેકટર
- ❖ **રીમોટ સેન્સિંગ** (હવાઈ ફોટોગ્રાફી સેટેલાઇટ ઇમેજીંગ): જીઓગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ સેન્સર્સ, બ્લોબલ પ્રોસિજરનિંગ સિસ્ટમ (જીપીએસ)
- ❖ **કાપણી પણીની માવજત:** પેકેજિંગ, સંગ્રહ, માર્કટિંગ, મોડીફાઇડ અને કન્ટ્રોલ એટમોસ્ટિકઅરિક પેકેજ
- ❖ **ઇન્ફર્મેશન ટેકનોલોજી એપ્લીકેશન:** ટેકનોલોજી પ્રસાર-પ્રચાર, હવામાન આધારિત પ્રસારણ

# કૃષિ મશીનરી / સાધનો

**ઓટોમેટિક ઈરીગેશન કંટ્રોલર:** ખેતરમાં નિયત માત્રામાં  
પિયત આપવા માટે વપરાય છે.

- પાણીના જથ્થા અને સમયના આધારે પિયત
- કલાઈમેટિક પેરામીટરના આધારે પિયત
- પાણીની બચત અને ઉત્પાદનમાં વધારો
- મજુરી ખર્ચમાં ઘટાડો
- કિમત: રૂ. ૨૫૫૦



# કૃષિ મશીનરી / સાધનો

**મોનિટરીંગ સીસ્ટમ:** વિશ્વના કોઈ પણ ખૂણેથી ખેતરનું તાપમાન, હ્યુમીડિટી અને જમીનનો બેજ જાળવા


- તાપમાન અને હ્યુમીડિટીના આધારે નિર્ણયો લઇ શકાય
- જમીનના બેજની જાળકારીથી પિયત આધારિત નિર્ણય લઇ શકાય



# કૃષિ મશીનરી / સાધનો

સોઇલ મોઈસ્ટચર સેન્સર: જમીનમાં રહેલ ભેજ માપવા માટે વપરાય છે.


- જમીનમાં રહેલ ભેજના આધારે પિયત
- પાણીની નોંધપાત્ર બચત
- કિમત: રૂ. ૨૬૦



# કૃષિ મશીનરી / સાધનો

## સ્માર્ટ ફાર્મિંગ સીસ્ટમ

- વાયર લેસ ડેટા ટ્રાન્સફર
- રિમોટ મોનિટરિંગ: જમીનનો ભેજ,  
EC અને જમીનનું તાપમાન
- ઓટોમેટિક ઈરીગેશન કન્ટ્રોલ



# કૃષિ મશીનરી / સાધનો

**સુદ્ધમ પિયત પદ્ધતિઓ:** ચોકસાઈથી પિયત આપવા માટે વપરાય છે.

- પાક ઉત્પાદનમાં વધારો
- પાણી, ઊર્જા અને ખાતરની બચત
- મજુરી ખર્ચમાં ઘટાડો
- પિયત કાર્યક્રમતા: ૮૫% થી વધારે



# કૃષિ મશીનરી / સાધનો

**ચોકસાઈ વાળું બીજ વાવણી યંત્ર:** ઘઉં, બાજરી, તલ, જેવા પાકોના વાવેતર માટે વપરાય છે.

- હરોળ થી હરોળ અંતરની જાળવણી
- બીજ થી બીજનાં અંતરની જાળવણી
- બીજના વ્યયમાં ઘટાડો
- એકમ વિસ્તારમાં જરૂરી સીડ રેટ



# કૃષિ મશીનરી / સાધનો

**લેઝર લેન્ડ લેવલર:** ઝડપી અને ઓછા ખર્ચે વધુ ચોકસાઈ પૂર્વક જમીન સમતલ કરવા માટે વપરાય છે.

- પાણીની બચત અને ઉત્પાદનમાં વધારો
- રાસાયનિક ખાતરનો કાર્યક્રમ ઉપયોગ
- વીજળીની બચત અને સિંચાઈની કાર્યક્રમતામાં વધારો
- જમીન ક્ષાર નિયંત્રણ



# કૃષિ મશીનરી / સાધનો

ટ્રેક્ટર સંચાલિત ઓટોમેટેડ ઇન્ટર અને ઇન્ટ્રા રો વીડર: પાકની હરોળ વરચેના।

તેમ જ બે છોડ વરચેના નિંદણ દુર કરવા વપરાય

- માણસો છારા કરાતા નિંદામણ ની સરખામણીમાં ૮૮.૮૪ % સમય અને ૩૫.૩૭ % ખર્ચનો બચાવ
- નીંદણ કાર્યક્ષમતા: ૯૩.૯૫%



# કૃષિ મશીનરી / સાધનો

## સૌર (ઉર્જા દ્વારા) સંચાલિત રિમોટ કંટ્રોલ સ્પ્રેયર:

- ખેતરના સેઢા-પાળા પર ઉભા રહી રસાયણનો છંટકાવ શક્ય
- બેટરી દ્વારા ચાલતું હોય સૌર ઉર્જા દ્વારા ચાર્જિંગ
- છંટકાવ માટે ખુબ ઓછો ખર્ચ



# કૃષિ મશીનરી / સાધનો

## સૌરઊર્જથી સંચાલીત નિંદામળાનાશક ચંત્રઃ

- મગફળી, ચણા, કપાસ જેવા પાકોમા બે હરોળ વર્ચે થતા નિંદણ ને દૂર કરવા માટે વપરાય છે.
- સૌરઊર્જથી ચાલતું હોય પેટ્રોલ/ડિઝલ નો બચાવ
- કાર્યક્ષમતા: ૫ ગુંઠા/કલાક



# કૃષિ મશીનરી / સાધનો

ઓરણીના ડાંડવા જમ થાય તે જાળ કરતી

**સિસ્ટમ:** ચોમાસામા મગફળીના વાવેતર સમયે

વપરાય છે.

- વાવેતર કરતી વખતે જમીનમા રહેલા ભેજના લીધે અમુક વખત ઓરણીમા રહેલા ડાંડવા જમ થય જતા હોય છે.
- જેથી આ સેન્સર તે સમયે એલાર્મથી ખેડુતને જાળ કરવા માટે ઉપયોગી છે.



# કૃષિ મશીનરી / સાધનો

રીમોટ કંટ્રોલ મેકાટ્રોનિક પ્રીસીજન પ્લાન્ટર:

કપાસ, તુવેર, એરંડા, જેવા પાકોના વાવેતર  
માટે વપરાય છે.

- છોડ થી છોડના અંતરની જાળવણીમાં  
ચોકસાઈ
- ૧ કિમી ની રેન્જ સુધી રીમોટ ફ્લારા  
ચલાવાવું શક્ય
- સિંગલ ચાર્જિંગ: ૨ કલાક ૧૫ મિનીટ



# કૃષિ મશીનરી / સાધનો

**ફોલ્ડેબન પ્લાસ્ટિક બોક્સ:** ફળો તથા શાકભાજીના પરીવહન માટે વપરાય છે.

- ફળો તથા શાકભાજી એકબીજા પર સહેલાયથી ગોઠવી શકાય
- સેલ નાના મોટા કરી શકાય
- બોક્સ વખતો વખત વાપરી શકાય
- ફોલ્ડ કરી શકવાથી ખાલી બોક્સનો પરીવહન ખર્ચ ઘટાડી શકાય



# પ્રીસિઝન ફાર્મિંગની સમસ્યાઓ

- રોકાણ:** પ્રીસિઝન ફાર્મિંગનો અમલ કરવા માટે સાચા અર્થમાં જોઈએ તો તેના માટે જરૂરી ઉપકરણો કિમતમાં મૌંઘા હોવાથી ખેડૂતે શરૂઆતમાં મૂડીનું રોકાણ કરવું પડે છે.
- તજજ્ઞતા:** ખેડૂત પાસે મહંગ અંશો પાક આધારિત પાચાનું જ્ઞાન અને વિવિધ સાધનો વાપરની તજજ્ઞતા હોવી જરૂરી છે.
- નાના ખેતરો:** આપણા દેશમાં નાના અને સીમાંત ખેડૂતો હોવાને કારણે જમીનના ટુકડા હોવાથી પ્રીસિઝન ફાર્મિંગ અમલમાં મૂકવા માટે મુશ્કેલી પડે છે.
- અન્ય:** પ્રીસિઝન ફાર્મિંગના અમલીકરણ માટે સફળ વાતાનો અભાવ, અચોક્કસ બજારવ્યવસ્થા, માળખાકીય સુવિધાનો અભાવ, સ્થાનિક તાંત્રિક નિષ્ણાંતનો અભાવ, સાઇટ સ્પેસ્શિફ્ટ ગુણાતાસભર ડેટાનો અભાવ અને ખર્ચ, જ્ઞાન અને તાંત્રિકતા વરચેની ઉણાપ, ખેડૂતોનું વલણ વગેરે સમસ્યાઓ રહેલી છે.

# પ્રીસિઝન ફાર્મિંગની સમસ્યાઓ

- મર્યાદાઓ હોવા છતાં એમ ધારી લેવું ચોગ્ય નથી કે પ્રીસિઝન ફાર્મિંગ અપનાવવું અનુકૂળ નથી.
- પ્રીસિઝન ફાર્મિંગ એ ફક્ત અધતન ઉપકરણોનો ઉપયોગ નથી પરંતુ તે ચોગ્ય તાંત્રિક માહિતી મેળવી તેના પ્રત્યક્ષ ઉપયોગને સુનિશ્ચિત કરે છે.
- ઓછી થતી જતી ખેતીલાયક જમીન અને વધતી જતી વસ્તીના દબાણ સાથે કદમ મેળવવા માટે એકમ વિસ્તારની ઉત્પાદકતા વધારવી ખૂબ જ આવશ્યક છે. સાથે સાથે પર્યાવરણ પર થતું નુકશાન ઘટાડવું પણ જરૂરી છે.
- પ્રીસિઝન ફાર્મિંગની સફળતાનો આધાર અંશતઃ સંકલિત વ્યવસ્થામાં ચોગ્ય માહિતી મેળવી અને તાંત્રિકતા એકત્રિત કરી તેનો ઉપયોગ વિવિધ પાકપદ્ધતિ પર કેવી રીતે કરવો તેના પર રહેલો છે.

# Thank you for attention !

